

12th August, 2025

To, Listing Department **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001.

Scrip Code: <u>526586</u>

Scrip ID: WIMPLAST

Sub: <u>Submission of Newspaper Advertisement regarding Unaudited Financial Results of the Company</u> for the first quarter ended 30th June, 2025

Dear Sir/ Madam,

In terms of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed herewith is the copy of Newspaper Advertisement of Unaudited Financial Results for the first quarter ended 30<sup>th</sup> June, 2025 published in Newspapers – Business Standard (English) and Gujarat Mitra (Gujarati) on 12<sup>th</sup> August, 2025.

The above information will also be made available on the Company's website: <a href="https://www.cellowimplast.com/">https://www.cellowimplast.com/</a>.

Kindly take the same on your record.

Thanking you.

Yours faithfully,

For Wim Plast Limited

Darsha Adodra
Company Secretary & Compliance Officer
(FCS: 12831)

End: A/a

#### **NACL Industries Limited**

CIN: L24219TG1986PLC016607 Regd. Office: Lakshmi Tower, Plot no12A, C-Block, Opp. Corporation Bank. Nagarjuna Hills, Punjagutta, Hyderabad, Telangana 500082 Email Id: investors@naclind.com Website:www.naclind.com Tel No.: 04024405100

NOTICE

Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares Pursuant to SEBI circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July 2025, the Company is pleased to offer an one-time special window fo investors to submit re-lodgement requests for the transfer of shares. This special window is open from 7th July 2025 to 6th January 2026 and is specially applicable to cases which were lodged prior to deadline of 1st April 2019 and the original hare transfer was rejected / returned / not attended due to deficiencies in documentation or were not processed due to any other reason. The shares relodged for transfer will be processed only in dematerialized form during this window

Eligible Investors may submit their transfer request along with the requisit documents to the Company's Registrar and Share Transfer Agent (RTA) at XL Softech Systems Limited, 3, Rd Number 2, Sagar Society, Sri Nagar Colony, Kamalapuri Colony, Banjara Hills, Hyderabad, Telangana 500034 Tel No: 040 23545913 Email: xlfield@gmail.com within the stipulated period Note: All Shareholders are requested to update their E-mail ID(s) with Company

RTA / Depository Participants.

Place : Hyderabad : 11-08-2025

for NACL Industries Limited Satish Kumar Subudhi Sr. Vice President - Legal & Company Secretary



#### **ELECON ENGINEERING COMPANY LIMITED**

CIN: L29100GJ1960PLC001082 • Website: www.elecon.con Regd. Off.: Anand-Sojitra Road, Vallabh Vidyanagar - 388120. Ph: (02692) 238701 / 238702 Email: investor.relations@elecon.com

#### **Notice to Shareholders** 100 Days' Campaign- "Saksham Niveshak"

Investor Education and Protection Fund Authority ('IEPFA') in line with the objectives of the Niveshak Shivir, and its broader drive for investor education and facilitation, has launched a 100 Days' Campaign — "Saksham Niveshak" from 28th July, 2025 to 6th November, 2025, targeting shareholders whose dividends have remained unpaid/unclaimed. As per the directives of IEPFA, Elecon Engineering Company Limited ('the Company') has initiated the 100 Days' Campaign for the shareholders, whose dividend are unpaid/unclaimed, the notice is being issued by the Company as a part of the aforementioned campaign.

All the shareholders who have unpaid/unclaimed dividend or those who are required to update their Know Your Client ('KYC') & nomination details or have any issues/queries related to unpaid/unclaimed dividend and shares, are requested to write to the Company's Registrar and Share Transfer Agent ('RTA') at MUFG Intime India Private Limited, Unit: Elecon Engineering Company Limited, "Geetakunj", 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara - 390015 or at E-mail: vadodara@in.mpms.mufg.com. List of shareholders having unpaid/unclaimed dividend and the copy of the Circular of the same are available under the Investors section of the Company's website

The shareholders may further note that this campaign has been initiated specifically to reach out to the shareholders to update their KYC and nomination details. The Shareholders are requested to update their details and claim their unpaid/unclaimed dividend in order to prevent their shares or dividend being transferred to the IEPFA.

This notice is also available on the Company's website at www.elecon.com and the websites of the Stock Exchanges where the equity shares of the Company are listed i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and BSE Limited at www.bseindia.com

For, Elecon Engineering Company Limited, Place: Vallabh Vidvanagar

Date : 11<sup>th</sup> August, 2025

Bharti Isarani - Company Secretary

### **OSBI**

Transaction Banking – Solutions & Special Projects Department, Corporate Centre, 2nd floor, Mafatlal Centre, Nariman Point, Mumbai - 400021. -mail: dgmdebitcards.dtb@sbi.co.in, Website: https://bank.sbi, https://www.sbi.co.i

#### **NOTICE INVITING TENDER**

RFP No. TB S&SP/CARDS/ASK/2025-26/01 Dated: 07.08.2025 Bids are invited by State Bank of India from eligible bidders for RFP fo empanelment of Vendors for Procuring, Processing and Personalisation of Cards and related services. For details, please visit Procurement News a https://bank.sbi/.https://www.sbi.co.in.https://etender.sbi/.

ommencement of download of RFP: From 13.08.2025 at 11:00 hrs Last date and time for submission of bids: 15.09.2025 up to 15:00 hrs

Place: Mumbai Date: 12.08.2025

Deputy General Manager (Cards) TB - Solutions & Special Projects Department



CIN: L16005WB1910PLC001985 Registered Office: Virginia House, 37 Jawaharlal Nehru Road, Kolkata 700 071 Tel: +91 33 2288 9371 • Fax: +91 33 2288 2358 • E-mail: isc@itc.in

#### Re-lodgement of Transfer Requests for Shares of ITC Limited held in Physical Form

The Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from 7th July, 2025 to 6th January, 2026, to facilitate re-lodgement of transfer requests for shares held in physical form. This facility is available only for those transfer deeds which were originally submitted to the Company before 1st April, 2019 but were rejected or returned due to documentation deficiencies. Shareholders may re-lodge such transfer deeds after rectification, along with the necessary supporting documents, to the Investor Service Centre (ISC) of the Company.

It may be noted that ISC will be able to accept these share transfer requests only up to 6th January, 2026 in terms of SEBI Circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July, 2025. Further, as mandated by SEBI, all shares transferred under the specified window will be issued only in dematerialised form.

Shareholders may contact the ISC at the following details for any further information, assistance or clarification:

Address	37 Jawaharlal Nehru Road, Kolkata 700 071
Telephone nos.	1800-345-8152 (toll free), 033-2288 6426 / 0034
E-mail	isc@itc.in

ITC Limited R. K. Singhi Executive Vice President & Company Secretary Dated: 11th August, 2025





MUTHOOT MICROFIN LIMITED: Regd. Office: 13th Floor, Parinee Crescenzo, Bandra Kurla Complex, Bandra East, Mumbai, Maharashtra -400051

Admin Office: 5th Floor, Muthoot Towers, Opp Abad hotel, M G Road, Kochi, Kerala -682035

Extract of Statement of unaudited Financial Results for the quarter ended June 30, 2025 (All amounts are in Millions of Indian Rupees, unless otherwise stated)

Discrimination   Dis				Quarter ended		Year ended	
Total Income from Operations   5,586.22   5,550.33   6,634.67   25,61	SI. No	Particulars	June 30, 2025	March 31, 2025	June 30, 2024	March 31, 2025	
2       Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)       57.61       (5,217.12)       1,465.59       (2,889)         3       Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)       57.61       (5,217.12)       1,465.59       (2,889)         4       Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)       61.84       (4,011.50)       1,132.23       (2,225)         5       Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) and Other Comprehensive Income (after tax)]       82.34       (3,782.14)       1,156.09       (1,805)         6       Paid up Equity Share Capital       1,675.97       1,675.97       1,675.23       1,67         7       Reserves (excluding Revaluation Reserves)       -       -       -       24,64         8       Securities Premium Account       16,001.64       16,001.64       15,995.96       16,00         9       Net worth       26,413.43       26,322.27       29,241.29       26,32         10       Paid up Debt Capital (Outstanding Debt)       74,679.31       79,264.21       84,084.67       79,26         11       Outstanding Redeemable Preference Shares       Nii       Nii       Nii <t< th=""><th></th><th></th><th>Unaudited</th><th>Audited</th><th>Unaudited</th><th>Audited</th></t<>			Unaudited	Audited	Unaudited	Audited	
Exceptional and/or Extraordinary items   S7.61 (5,217.12)	1	Total Income from Operations	5,586.22	5,550.33	6,634.67	25,616.93	
Exceptional and/or Extraordinary items   S7.61   S7	2	Net Profit/(Loss) for the period (before Tax,	E7 61	(5,217.12)	4 465 50	(2,889.04)	
Exceptional and/or Extraordinary items   S7.61 (5,217.12)		Exceptional and/or Extraordinary items)	37.01		1,405.59		
Exceptional and/or Extraordinary items   Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)   1,132.23   (2,225	2	Net Profit/(Loss) for the period before Tax (after	57.61	(5 217 12)	1 465 50	(2.880.04)	
Exceptional and/or Extraordinary items)    Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]    Paid up Equity Share Capital   1,675.97   1,675.97   1,675.23   1,675.23   1,677   1,675.23   1,677   1,675.23   1,677   1,675.23   1,675.23   1,677   1,675.23   1,675.23   1,675.23   1,675.23   1,675.23   1,675.23   1,675.23   1,675.23   1,675.		Exceptional and/or Extraordinary items)	37.01	(3,217.12)	1,465.59	(2,009.04)	
Exceptional and/or Extraordinary items)  Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]  6 Paid up Equity Share Capital 1,675.97 1,675.97 1,675.23 1,67  7 Reserves (excluding Revaluation Reserves) 24,64  8 Securities Premium Account 16,001.64 16,001.64 15,995.96 16,00  9 Net worth 26,413.43 26,322.27 29,241.29 26,32  10 Paid up Debt Capital (Outstanding Debt) 74,679.31 79,264.21 84,084.67 79,266  11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil Nil  12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88  13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13  2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13  14 Capital Redemption Reserve Nil Nil Nil Nil  15 Debenture Redemption Reserve Nil Nil Nil Nil  16 Debt Service Coverage Ratio Not applicable Not applic	1	Net Profit/(Loss) for the period after Tax (after	61 84	(4 011 50)	1 122 22	(2,225.23)	
5   [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) and Other Comprehensive Income (after tax)]		Exceptional and/or Extraordinary items)	01.84	(4,011.30)	1,132.23	(2,223.23)	
tax) and Other Comprehensive Income (after tax)]  6 Paid up Equity Share Capital 1,675.97 1,675.97 1,675.23 1,67  7 Reserves (excluding Revaluation Reserves) 24,64  8 Securities Premium Account 16,001.64 16,001.64 15,995.96 16,00  9 Net worth 26,413.43 26,322.27 29,241.29 26,32  10 Paid up Debt Capital (Outstanding Debt) 74,679.31 79,264.21 84,084.67 79,266  11 Outstanding Redeemable Preference Shares Nill Nill Nil  12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88  13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13  2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13  14 Capital Redemption Reserve Nill Nil Nil  15 Debenture Redemption Reserve Nill Nil Nil  16 Debt Service Coverage Ratio Not applicable Not applicab		Total Comprehensive Income for the period					
tax) and Other Comprehensive Income (after tax)]  6 Paid up Equity Share Capital 1,675.97 1,675.97 1,675.23 1,67  7 Reserves (excluding Revaluation Reserves) 24,64  8 Securities Premium Account 16,001.64 16,001.64 15,995.96 16,00  9 Net worth 26,413.43 26,322.27 29,241.29 26,32  10 Paid up Debt Capital (Outstanding Debt) 74,679.31 79,264.21 84,084.67 79,26  11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil Nil  12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88  13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13  2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13  14 Capital Redemption Reserve Nil Nil Nil Nil  15 Debenture Redemption Reserve Nil Nil Nil Nil  16 Debt Service Coverage Ratio Not applicable Not a	5		82 34	(3,782.14)	1,156.09	(1,805.85)	
6       Paid up Equity Share Capital       1,675.97       1,675.97       1,675.23       1,67         7       Reserves (excluding Revaluation Reserves)       -       -       -       24,64         8       Securities Premium Account       16,001.64       16,001.64       15,995.96       16,00         9       Net worth       26,413.43       26,322.27       29,241.29       26,32         10       Paid up Debt Capital (Outstanding Debt)       74,679.31       79,264.21       84,084.67       79,26         11       Outstanding Redeemable Preference Shares       Nil       Nil       Nil       Nil         12       Debt Equity Ratio (No. of times)       2.83       3.01       2.88         13       Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -       -       -         1.Basic (EPS) (₹)*       0.37       (23.54)       6.77       (13         2.Diluted (DPS) (₹)*       0.36       (23.33)       6.65       (13         14       Capital Redemption Reserve       Nil       Nil       Nil         15       Debenture Redemption Reserve       Nil       Nil       Nil         16       Debt Service Coverage Ratio       Not applicable       Not applicable       Not app	,	tax) and Other Comprehensive Income (after	02.54				
7         Reserves (excluding Revaluation Reserves)         -         -         -         24,64           8         Securities Premium Account         16,001.64         16,001.64         15,995.96         16,00           9         Net worth         26,413.43         26,322.27         29,241.29         26,32           10         Paid up Debt Capital (Outstanding Debt)         74,679.31         79,264.21         84,084.67         79,26           11         Outstanding Redeemable Preference Shares         Nil         Nil         Nil         Nil           12         Debt Equity Ratio (No. of times)         2.83         3.01         2.88           13         Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -         -         -           1.Basic (EPS) (₹)*         0.37         (23.54)         6.77         (13           2.Diluted (DPS) (₹)*         0.36         (23.33)         6.65         (13           14         Capital Redemption Reserve         Nil         Nil         Nil         Nil           15         Debenture Redemption Reserve         Nil         Nil         Nil         Nil           16         Debt Service Coverage Ratio         Not applicable         Not applicable         Not applicable		tax)]					
8 Securities Premium Account 16,001.64 16,001.64 15,995.96 16,00 9 Net worth 26,413.43 26,322.27 29,241.29 26,32 10 Paid up Debt Capital (Outstanding Debt) 74,679.31 79,264.21 84,084.67 79,26 11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil 12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88 13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - 1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13 2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13 14 Capital Redemption Reserve Nil Nil Nil 15 Debenture Redemption Reserve Nil Nil Nil 16 Debt Service Coverage Ratio Not applicable Not	6	Paid up Equity Share Capital	1,675.97	1,675.97	1,675.23	1,675.97	
9 Net worth 26,413.43 26,322.27 29,241.29 26,32 10 Paid up Debt Capital (Outstanding Debt) 74,679.31 79,264.21 84,084.67 79,26 11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil 12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88 13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - 1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13 2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13 14 Capital Redemption Reserve Nil Nil Nil 15 Debenture Redemption Reserve Nil Nil Nil 16 Debt Service Coverage Ratio Not applicable Not appl	7	Reserves (excluding Revaluation Reserves)	-	-	-	24,646.30	
10    Paid up Debt Capital (Outstanding Debt)   74,679.31   79,264.21   84,084.67   79,264.11   Outstanding Redeemable Preference Shares   Nil	8	Securities Premium Account	16,001.64	16,001.64	15,995.96	16,001.64	
11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil Nil 12 Debt Equity Ratio (No. of times) 2.83 3.01 2.88  13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1.Basic (EPS) (₹)* 0.37 (23.54) 6.77 (13 2.Diluted (DPS) (₹)* 0.36 (23.33) 6.65 (13 14 Capital Redemption Reserve Nil Nil Nil Nil 15 Debenture Redemption Reserve Nil Nil Nil Nil 16 Debt Service Coverage Ratio Not applicable N	9	Net worth	26,413.43	26,322.27	29,241.29	26,322.27	
12     Debt Equity Ratio (No. of times)     2.83     3.01     2.88       13     Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -        1.Basic (EPS) (₹)*     0.37     (23.54)     6.77     (13       2.Diluted (DPS) (₹)*     0.36     (23.33)     6.65     (13       14     Capital Redemption Reserve     Nil     Nil     Nil       15     Debenture Redemption Reserve     Nil     Nil     Nil     Nil       16     Debt Service Coverage Ratio     Not applicable	10	Paid up Debt Capital (Outstanding Debt)	74,679.31	79,264.21	84,084.67	79,264.21	
13 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -  1.Basic (EPS) (₹)*  2.Diluted (DPS) (₹)*  0.36 (23.33) 6.65 (13  14 Capital Redemption Reserve  Nil Nil Nil  15 Debenture Redemption Reserve  Nil Nil Nil  Nil  16 Debt Service Coverage Ratio  Not applicable	11	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil	Nil	
1.Basic (EPS) (₹)*   0.37   (23.54)   6.77   (13   2.Diluted (DPS) (₹)*   0.36   (23.33)   6.65   (13   14   Capital Redemption Reserve   Nil   Nil   Nil   Nil   15   Debenture Redemption Reserve   Nil   Nil   Nil   Nil   Nil   16   Debt Service Coverage Ratio   Not applicable   Not applicab	12	, , , ,			2.88	3.01	
2.Diluted (DPS) (₹)*   0.36   (23.33)   6.65   (13.34)       14   Capital Redemption Reserve   Nil   Nil   Nil     15   Debenture Redemption Reserve   Nil   Nil   Nil   Nil     16   Debt Service Coverage Ratio   Not applicable   Not applicab	13	Earnings Per Share (of Rs.10/- each) (for continuing	g and discontinue	d operations) -			
14     Capital Redemption Reserve     Nil     Nil     Nil       15     Debenture Redemption Reserve     Nil     Nil     Nil       16     Debt Service Coverage Ratio     Not applicable     Not applicable     Not applicable       17     Interest Service Coverage Ratio     Not applicable     Not applicable     Not applicable     Not applicable		1.Basic (EPS)(₹)*	0.37	(23.54)	6.77	(13.29)	
15     Debenture Redemption Reserve     Nil     Nil     Nil       16     Debt Service Coverage Ratio     Not applicable     Not applicable     Not applicable       17     Interest Service Coverage Ratio     Not applicable     Not applicable     Not applicable     Not applicable		2.Diluted (DPS)(₹)*	0.36	(23.33)	6.65	(13.07)	
16Debt Service Coverage RatioNot applicableNot applicableNot applicableNot applicableNot applicable17Interest Service Coverage RatioNot applicableNot applicableNot applicableNot applicable	14	Capital Redemption Reserve	Nil	Nil	Nil	Nil	
17 Interest Service Coverage Ratio Not applicable Not applicable Not applicable Not applicable	15	Debenture Redemption Reserve	Nil	Nil	Nil	Nil	
	16	Debt Service Coverage Ratio	Not applicable	Not applicable	Not applicable	Not applicable	
*FPS is not annualized for the quarter	17	Interest Service Coverage Ratio	Not applicable	Not applicable	Not applicable	Not applicable	
Er 5 is not annualized for the quarter.							

# Notes:

Place: Kochi

Date: August 11, 2025

- The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of financial results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and on Company's Website at www.muthootmicrofin.com
- b) The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on August 11, 2025.
- The Financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under section 133 of the Companies Act 2013 ("the Act") read with Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended by Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2023.
- d) For other line items referred in regulation 52(4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange (BSE) and can be accessed on www.bseindia.com

For and on behalf of the Board of Directors of Muthoot Microfin Limited

Thomas Muthoot John **Executive Director** DIN: 07557585

cello Wim Plast Ltd.

Regd. Office: Survey No.324 / 4 to 7 of Kachigam, Village Kachigam, Daman-396 210. Tel.: (022) 69970010 | Email: wimplast@celloworld.com

CIN: L25209DD1988PLC001544 | Website: www.cellowimplast.com

# UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

The Unaudited Financial Results (Standalone & Consolidated) along with Limited Review Report of the Statutory Auditor for the quarter ended June 30, 2025, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on August 11, 2025.

The full format of Unaudited Financial Results (Standalone & Consolidated) along with Limited Review Report of the Statutory Auditor is available on the website of BSE at www.bseindia.com and on the Company's website at www.cellowimplast.com.

In compliance with Regulation 47 of the Listing Regulations, we hereby notify that the same can also be accessed by scanning the following Quick Response (QR) code:



For and on behalf of the Board of Directors Wim Plast Limited Sd/-

Pradeep G. Rathod (CEO, Chairman & Managing Director) (DIN - 00027527)

**Date: August 11, 2025** Place: Mumbai

# cello

### **CELLO WORLD LIMITED**

(Formerly known as CELLO WORLD PRIVATE LIMITED) Regd off.: 597/2A Somnath Road, Dabhel, Nani Daman - 396210, Daman & Diu CIN L25209DD2018PLC009865 Contact No.: +91 22 6997 0000 Website: www.corporate.celloworld.com Email: grievance@celloworld.com

#### UNAUDITED CONSOLIDATED AND STANDALONE FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED JUNE 30, 2025

The Unaudited Financial Results (Consolidated & Standalone) alongwith Limited Review Reports of the Statutory Auditor of the Company for the first quarter ended June 30, 2025. filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on August 11, 2025.

The full format of Unaudited Financial Results (Consolidated & Standalone) along with Limited Review Reports of the Statutory Auditor is available on the website of BSE at www.bseindia.com and National Stock Exchange Limited at www.nseindia.com on the Company's website at www.corporate.celloworld.com. In compliance with Regulation 47 of the Listing Regulations, we hereby notify that the same can also be accessed by scanning the following Quick Response (QR) code:

Date: August 11, 2025 Place: Mumbai

For and on behalf of the Board of Directors CELLO WORLD LIMITED

Sd/-

Pradeep G. Rathod Chairman & Managing Director DIN-00027527



WE'LL MAKE IT

#### **RUSHIL DECOR LIMITED** Regd. Office: S. No.149, Near Kalyanpura Patia, Vill. Itla,

Gandhinagar Mansa Road, Tal. Mansa, Dist. Gandhinagar -382845, Gujarat, India Corporate Office: Rushil House, Near Neelkanth Green Bungalow, Off. Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380059, Gujarat, India. Ph.:+91-079-61400400 E-mail: ipo@rushil.com Website: www.rushil.com

CIN: L25209GJ1993PLC019532

Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2025

(₹ in Million, except per share data									
	Standalone				Consolidated				
Particulars	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter 30.06.2024 (Unaudited)	Year ended 30.06.2025 (Audited)	
Total income from operations	1772.87	2288.14	2234.98	8913.39	1791.57	2307.33	2250.92	8979.44	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(181.38)	133.73	164.91	609.65	(185.29)	130.84	166.03	605.41	
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(181.38)	153.69	164.91	629.61	(185.29)	150.80	166.03	625.38	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(136.83)	128.80	123.11	483.05	(140.69)	126.06	123.95	478.75	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(136.68)	129.89	122.95	483.65	(140.54)	127.15	123.79	479.35	
Equity Share Capital	293.42	286.82	270.47	286.82	293.42	286.82	270.47	286.82	
Reserves as shown in the Audited Balance Sheet	-	-	-	6040.98	-	-	-	6038.8	
Earnings Per Share (of ₹ 1/- each) (Not Annualised for quarters)									
1.Basic :	(0.48)	0.46	0.46	1.77	(0.49)	0.45	0.46	1.75	
2.Diluted:	(0.48)	0.43	0.41	1.65	(0.49)	0.42	0.41	1.63	

1) The above unaudited standalone and consolidated financial results for the quarter end June 30, 2025 have been reviewed by the audit committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on August 11,2025.

2) The above unaudited standalone and consolidated financial results for the quarter ended June 30,2025 have been prepared in accordance with Indian AS are prescribed under section 134 of the Companies Act. 2013.

3) The Company raised the funds by way of issue of Convertible Warrants on Preferential Basis to the Promoter Group and Non-Promoters in the board meeting held on 26.10.2023 and the same was approved in the Extraordinary General Meeting held on 18.11.2023. On 23.12.2023, the Company allotted 41,30,000 Convertible Warrants at an issue price of Rs. 297/- per warrant to Promoter Group and Non-Promoters as approved by the general body and in terms of the In-Principle approval accorded by the exchanges on 12.12.2023. Further, the equity shares of the Company were sub-divided from 1 share of Rs. 10 each to 10 shares of Rs. 1 each having record date 09.08.2024. The company received an amount of Rs 147.02 Million during the current quarter. The Company has received total amount of Rs 930.35 Million June 30, 2025. 4) The Utilisation of the Net Proceeds towards the Objects of the Preferential issue through Convertible Warrants is summarised below

Amount to be funded from the Net Proceeds (₹. In Million)	Amount incurred till 30.06.2025 (₹. In Million)
900.00	686.61
100.00	0.00
100.00	89.59
126.61	33.57
1226.61	809.77
	from the Net Proceeds (₹. In Million)  900.00  100.00  100.00  126.61

<ol><li>Key Standalone Financial information.</li></ol>				(₹ in Million)
Particulars	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)
Total income from operations	1772.87	2288.14	2234.98	8913.39
Net Profit for the Period before Taxes	(181.38)	133.73	164.91	609.65
Net Profit for the Period after Taxes	(136.83)	128.80	123.11	483.05

6) During the quarter, the company recognized a total foreign exchange loss of INR 57.09 million, primarily on account of the revaluation of its ECA loan in EURO. This has been recorded under the other expenses as foreign exchange fluctuation loss in the financial results. 7) The Company in support of "Saksham Niveshak" campaign initiated by IEPF Authority, earge the investor to Comply KYC Norms as prescribed with their respective Depositories and the Company to initiate through E Notice , Annual Report and News paper publications , for providing

guidance to the investors to resolve issue relating to unclaimed dividend and shares. 8) The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website viz. www.bseindia.com and www.nseindia.com and also on the company's website www.rushil.com/investor\_relationship. The result can also be accessed by scanning the QR code provided 9) Previous period figures have been re-arranged/re-grouped wherever necessary.



Place: Ahmedabad Date: 11th Aug, 2025



For, Rushil Décor Limited Krupesh G. Thakkar Chairman DIN:01059666

LAMINATE | MDF | PVC | PLY

# ગુજરાતમાં કોંગ્રેસ મતદાર યાદીની ઘરે ઘરે જઈ ચકાસણી કરશે

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના આક્ષેપ સાથે અભિયાન હાથ ધરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ આ મુદ્દે ગુજરાતના મતદારોની યાદીની ચકાસણી હાથ ધરશે, તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જે

GOLDEN CAREER OPPORTUNITY VACANCY FOR MANAGER Leading Life Insurance company in Surat is hiring smart & result-oriented individuals Experienced (Finance Field) Fix Payout Rs. 50,000 - Freshers Rs. 25,000+

 Excellent growth opportunities Training & professional support provide Location: Surat

98259 49649

Good Incentive

રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીના આક્ષેપ સાથે દેશભરમાં અભિયાન ચલાવ્યું છે त्यारे गुपरातना भतधारोनी याही પણ તપાસવામાં આવશે. ભાજપ ચૂંટણી પંચનો દુરુપયોગ કરી રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તીઓ ઘરે ઘરે જઈ તપાસ કરશે. ગુજરાતમાં મતદાન યાદી ચકાસો ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

# મોજે મોરામાં આવેલ સ્ટાર રો હાઉસનાં પ્લોટ નં.સી-૨૭ વાળી મિલકતનાં વેચાણ અંગેની જાહેર નોટીસ

આથી આ જાહેર નોટીસ થકી જાહેર જનતાને જણાવવાનું કે, સુરત ડીસ્ટ્રીકટ ચોર્યાસી સબ ડીસ્ટીકટના મોજે ગામ મોરાનાં રે. સર્વે નં.૯૨/૪ તથા ૯૨/૫ વાળી એન.એ. થયેલી જમીનમાં આયોજીત ''સ્ટાર રો-હાઉસ'' ના નામથી ઓળખાતી સોસાયટીમાં પાડવામાં આવેલા પ્લોટો પૈકી **પ્લોટ નં. સી-૨૭** બાંધકામ વાળી મિલકતનાં માલિક **શીતલબેન પિયુષભાઇ પટેલ** ની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટા, વહીવટ, લાગભાગ હેઠળ ચાલી આવેલ છે, સદરહુ મિલકત મારા અસીલે તેઓ પાસેથી ખરીદ કરવાનું નકકી કરેલ છે અને ટુંક સમયમાં તેઓ પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી લેનાર છે, તો સદરહુ મિલકતના વેચાણ બાબતે જે કોઇ વ્યક્તિ, સંસ્થા, સરકારી, અર્ધસરકારી કચેરીઓ વિગેરેને કોઇપણ પ્રકારનો વાંધો તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તમામ પુરાવા સાથે લેખીતમાં નીચે જણાવેલ સરનામે મળવું, સમય મર્યાદા પસાર થયા બાદ સદરહુ મિલકત માલીક પાસેથી મારા અસીલ સદરહુ મિલકતનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી લેશે, ત્યારબાદ પાછળથી કોઇના પણ વાંધા, વિરોધ, તકરાર આવશે તો તે વેવ થયેલા એટલે કે રદબાતલ ગણાશે.સહી. તા. ૧૨/૦૮/૨૦૨૫

તુષાર પી. પ્રજાપતિ હેમંત એમ. **પટેલ** M એડવોકેટ એન્ડ નોટરી

તે ખરીદનારનાં એડવોકેટસ્ ઓફીસઃ ૧૧૦, ૧૧૦/એ, શિવકૃપા એપાર્ટમેન્ટ, રામનગર, રાંદેર રોડ, સુરત મો.નં. ૯૮૨૪૩ ૯૨૯૩૧, ૯૭૨૫૧ ૦૯૧૨૫



બીઓ : પારડી (૭૯૪૩૦૦) : ઝૈનબ કોમ્પલેશ, ને.હા.નં. ૪૮ નજીક, પારડી, જી.વલસાડ– ૩૯૬૧૨૫ email: bo7943@pnb.co.in Tel: 0260- 2373738

કબજા નોટીસ (સ્થાયી મિલકત માટે) આથી નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓર કાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને તેમને મળેલ સત્તા હેઠળ અ

કાવનાાન્યવલ અસટ્સ અન્ક અન્કાસનન્ય આફ સફક્યાસ્ટા ઇન્ટરસ્ટ અકદ, ૨૦૦૨ અને તમને મળવે સત્તા હઠળ આ ધારા ૧૩(૧૨) સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સનેન્ટ) ટ્લર, ૨૦૦૨ ના ૩લ ૩ સાથે વંચાશે લઈ **તા.૧૮.૧૧.૨૦૨૪** ના રોજ ડિમાન્ડ નોટીસ બજાવીને દેવાદારો/**ગીરવેદાર નસીર હમીદ શેખ (દેવાદાર અને ગીરવેદાર)** ને નોટીસમાં દેશાવેલ ૨કમ રૂા.૬,૯૮,૭૮૦.૮૨/– (અંકે રૂા. છ લાખ અઠાજું હજાર સાતસો એંસી અને બ્યાંસી પૈસા પુરા) તા.૩૧.૧૦.૨૦૨૪ ના રોજના માસિક ગણતરીના આધારે વધારાનું વ્યાજ અને અન્ય ચાર્જીસ અને ખર્ચાઓ સાથે આ નોટીસ /તારીખ મળ્યાના ၄૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવવામાં આવ્યું હતું.
દેવાદારો આ રકમ ચુકવવામાં અસફળ રહેલ છે. આથી દેવાદાર/ ગીરવેદાર્ અને જાહેર જનતાને આ નોટીસથી

દુવાદારા આ રક્ષ્ય યુક્કવામાં અસકળ રહેલ છે. ઓથા દવાદારા ગારવદાર અને જાહર જનતાને આ નાટાસથા જણાવવામાં આવે છે કે ખાશા ૧૩ કલમ (૪) આ ઘારાના 3લ ૮ કિલ્કોચિંદિર ટેસ્ટર (એન્કોસેમેન્ટ) ડ્રલ્સ, ૨૦૦૨ સાથે વંચાણે લઈ **તા. ૧૧ ઓગષ્ટ ૨૦૨૫** ના રોજ નીચે દર્શાવેલ વિગતની મિલકતનો કબજો મેળવેલ છે. આથી વિગતમાં દર્શાવેલ દેવાદારો/ગીરવેદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે મિલકતો માટે કોઈ પણ વ્યવહાર કરવો નહિં એને જો કોઈપણ વ્યવહાર કરવો હોય તો **પંજાબ નેશનલ બેંક**ની બાકી ૨કમ **રૂ. ૧,૯૮૦,૭૮૦.૮૨/– (એક રૂ. છ લાખ અઠાલું હજાર સાતસો એસી અને બ્યાંસી પૈસા પુરા) તા.૩૧.૧૦.૨૦૨૪ ના રોજના અને તેના ઉપર વધારાનું વ્યાજઅને કોસ્ટ, ખર્ચાઓ વગેરે ને આધિન રહેશે. હે વહાદારોનું ધ્યાન દોરવાનું કે તમને નિયમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ મુજબ સુરક્ષીત મિલકતો છોડાવવા માટે પટતો સમય આપેલ છે.** 

– स्थायी भिलङतनुं वर्शन •

માઝ એપાર્ટમેન્ટ' તારીકે ઓળખાતી કોર્મશીયલ બિલ્ડીંગ કમ રહેણાંક ના ભોયતળીયા ની દુકાન નં. ૮ માપ ૨૩૦.૦ ચો.કુટ (૨૧.૩૭ ચો.મીટર) એનએ થયેલ જમીન સી.એસ.નં. ૩૦૯૪, ૩૦૯૫, ૩૦૯૬, ૨૨૪૩ અને ૧૯૫૦ મુ પારડી ( પારડી નગરપાલિકાની હદમાં ) ચીવલ રોડ એરીયા, તા. પારડી, જી. વલસાડ ખાતે આવેલ છે. જેની ચતુર્દિશા : **ઉત્તર તરક** દુકાન નં. ૦૭, **દક્ષિણ તરફ** : દુકાન નં. ૦૯**, પૂર્વ તરફ** : મોદી સ્ટ્રીટ રોડ માર્ગ, **પશ્ચિમ તરફ** : પેસેટ અને દુકાન નં. ૧૪

તારીખ : ૧૧/૦૮/૨૦૨૫ | સ્થળ : પારડી અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

बैंक ऑफ इंडिया BO

એસેટ રીકવરી શાખા : બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ, પમો માળ, સુરત મેઈન શાખા, ક્લાપીઠ લાલગેટ, સુરત, ગુજરાત –૩૯૫૦૦૩ કોન : ૯૯૨૪૮૬૯૭૬૮ ઈમેઈલ : ARB.Surat@bankofindia.co.

કબજા નોટીસ (સ્થાયી મિલકત માટે)(જુઓ રૂલ–૮(૧)

અથી નીચે સહી કરનાર ભેંક ઓફ ઈન્ડિયા, એસેટ રીકવરી શાખા, સુરત ના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રફશન ઓફ કાઈનાન્ચિયલ એસેટ્સ એન્ડ એન્કોસેમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ અને આ ધારાની કલમ ૧૩(૧૨) સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોસેમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૩ સાથે વંચાણે લઈ તેમને મળેલ સત્તાની રૂએ તા.૧૨.૦૭.૨૦૨૪ ના રોજ ડિયાન્ડ નોટીસ બજાવીને દેવાદર મેસર્સ રાજ્યુગ ટેશ્વટાઈલ, અને શ્રી દશાબેન અશોકભાઈ નાવરીયા, અને શ્રીમતી ઉર્મેલાબેન મહેશભાઈ વિરાશી, ને નોટીસમાં દર્શાવેલ કુલ બાકી ૨૭મ રૂપ,૦૦૭.૪૬ (એક રૂા.છપાંશી લાખ એકાવન હજાર સાત અને છેતાલીસ પુરા) તેના ઉપર વધારાના વ્યાજ સાથે તા. ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ સુધી અને અન્ય ચાર્જાસ આ નોટીસ ની તારીખ થી ૬૦ દિવસની અંદર પરત ચુકવી દેવાનું 

જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ની કલમ ૧૩ ની પેટા કલમ (૪) ના રૂલ ૮ હેઠળ તેમને આપવામાં આવેલ અધિકારથી **તા. ૦૮મી ઓગપ્ટ ૨૦૨૫** ના રોજ આ સંપત્તિનો **પ્રત્યક્ષ કબજો** સંબાળી લીધેલ છે.

સપાતાના પ્રત્યના કખજા સભાળા લાયલ છ. ખાસ કરીને દેવાદાર(રો)/ જામીનદાર(રો) અને સામાન્ય જાહેર જનતાને અહીં ચેતવણી આપીને સદરહ સંપત્તિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે સોદો ન કરવાનું જણાવવામાં આવે છે. સદરહ સંપત્તિ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તે બેંક ઓફ ઈન્જિયા, એસેટ રીકવરી શાખા, સુરત ના રા.૮૬,પ૧,૦૦૭,૪૬ (એક રૂા. છયાંશી લાખ એકાવન હજાર સાત અને છેતાલીસ પુરા) તેના ઉપર વધારાના વ્યાજ સાથે તો. ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ સુધી અને અન્ય ચાર્જાસ આધીન છે. રા ગાવા છે. દેવાદાર અને જામીનદાર નું ધ્યાન દોરવાનું કે તમને નિયમ ૧૩ ની પેટા કલમ ૮ ની જોગવાઈ મુજબ સુરક્ષીત મિલકતો

સુરક્ષિત કરેલ / ગીરવેમુકેલ સ્થાયી મિલકત/ સુરક્ષિત કરેલ મિલકતના ભાગોનું વર્ણન

નમામ ભાગ અને હિસ્સો ધરાવતી મિલ્કત કે જે દર્શન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટ્રેટ જમીન અને બિલ્ડીંગ નો પ્લોટ નં. ૫૦ અને . પ૧. એક પ્લોટનું માપ આશરે ૧૫૧.૧૬૨૪ ચો. વાર એટલે કે ૧૨૬.૩૯ ચો. મીટર, માપ ૪૬.૨૫૫૦ ર મીટર, (એક પ્લોટ) વણવહેંચાયેલ હિસ્સો સહિત અને રોડ, જમીન રે.સ. નં. ૧૭૦, બ્લોક નં. ૧૭૦ ગામ જોળવા, તા પલસાણા, જી. સુરત ખાતે આવેલ છે.

તા.: ૦૮.૦૮.૨૦૨૫, સ્થળ : સુરત

અધિકૃત અધિકારી, બેંક ઓફ ઇન્ડિયા, એસેટ રીકવરી શાખા



PM SHRI School JAWAHAR NAVODAYA VIDYALAYA

AFFILIATION NUMBER:440019 SCHOOL CODE:14048 UDISE: 24230125912 PHONES:02631-237280 क्वमार्ग्र: https://navodaya.gov.in/nvs/nvs-school/DANG/en/home Email: invsaputara@gmail.com No.4-06/Contract/JNVDANG/2025-26/749

WALK IN INTERVIEW

PM Shri Jawahar Navodaya Vidyalaya Saputara Dang (Gujarat) required following Staff purely on contract basis for Academic session 2025-26. Eligible and interested candidates are invited to attend walk-in-interview to be held at PM Shri Jawaha Navodava Vidvalava Saputara. Details of the interview schedule is as following: -

S. No.	Staff	Essential & Desirable Qualification	Honorarium/ Remuneration	Date of Interview
01	STAFF NURSE (FEMALE)  Recognized University/Institution or Regular course in B. Sc. Nursing from a recognized university /Institute or Post Basic B. Sc. Nursing from a recognized university/Institute.  Age between 18 to 35 years 2. Registered as a Nurse or Nurse Midwife (RN or RM) with any Indian / State Nursing Council. 3. Practical experience of two and half years in minimum 50 bedded hospital after acquiring (1) above. 4. Desirable: Working knowledge of Hindi/Gujrati & English.		Rs.40625/- per month (hard station)	<b>19-08-2025</b> 11.00 AM
02	Yoga Instructor (Female)	Graduation in any discipline and Post Graduate diploma in Yoga with 01- year experience. Or Diploma/Certificate in Yoga with 02 years' experience. Engagement: - 3 session in a week for 08 months.	Rs.12500/- per month for 8 months	<b>19-08-2025</b> 11.00 AM
03	Sports Coach Kho- Kho (Male/ Female)	1.B.P.Ed. and Experts in Kho Kho preference will be given to coaches having experience and proven track record.     Engagement: 16 session in a month for 05 months	Rs. 20000/- per month for 5 months	<b>19-08-2025</b> 11.00 AM
04	Sports Coach Volley ball (Male/ Female)	1.B.P.Ed. and Experts in Volley ball preference will be given to coaches having experience and proven track record.  Engagement: - 16 session in a month for 05 months	Rs. 20000/- per month for 5 months	<b>19-08-2025</b> 11.00 AM
05	Music Expert Qualified and skilled in instruments like Guiter, keyboard/Congo/Flute/ Harmonium/etc. preference will be given to candidates having proven track record in the field.  Engagement: - 06 session per week for 08 months.		Rs.25000/- per month for 08 months	<b>19-08-2025</b> 11.00 AM
06	Dance Expert	Degree/Diploma in any of the Indian classical/Folk dance forms/ Contemporary dance forms from recognized university/institution. preference will be given to candidates having proven track record in the field. Engagement: - 06 session per week for 08 months.	Rs.25000/- per month for 08 months	<b>19-08-2025</b> 11.00 AM

Age limit for S.No. 2 to 06 18 years to 50 years as on date of engagement, For Ex NVS Teachers maximum age limit will be 65 years as on date of engagemen The interested and eligible candidates may appear for walk in interview as scheduled along with filled up prescribed bio-data with original supporting documents & one set of xerox copy of all documents, passport size photos, Aadhar card, pan card, Bank (R.P. Tiwari)

Note: No TA/DA will be paid for attending the interview.

**તારીખઃ** ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ સ્થળઃ મુંબઈ

# મોજે વેડ,તા.ક્તારગામ,જી.સુરતના રેવન્યુ સર્વે નં-૧૦૬/રબ વાળી જમીન અંગેની જાહેર નોટીસ તથા જાહેર ચેતવણી

આથી સર્વે ને લાગતા વળગતા ને જણાવવાનું કે, સુરત ડિસ્ટ્રીકટ, સબ–ડિસ્ટ્રીકટ કતારગામના મોજેઃ વેડ ના રેવન્યુ સર્વે નં–૧૦૬/રબ વાળી ખેડખાતાની જુની શરતની જમીન જેનું કુલ્લે ક્ષેત્રફળ ૦–૩૩–૩૯ હે.આર.ચો.મી. છે જેનો આકાર રૂા.૧૦.૮૭ પૈસા છે તે જમીનમા રેવન્યુ રેકંડે અમોના અસીલ ધનસુખભાઈ ચુનીલાલ લાડ ઉર્ફે પ્રજાપતિનાઓનો વડીલોપાર્જીત વણવહેચાયેલ અવિભાજય હિસ્સાની જમીનના ધારણકર્તા તરીકે તેમજ મજકુર જમીનના ૭/૧૨ ના અન્ય ધારણકર્તા અમોના અસીલના સગા ભાઈ સન્મુખભાઈ ચુનીલાલ લાડનો વણવહેચાયેલ ૬૬૭.૮૦ ચો.મી. તથા અમોના માઈ મનહરભાઈ ચુનીલાલ ના સીધીલીટીના વારસદારો (૧) નયનાબેન તે મનહરભાઈ ચુનીલાલ ની વિધવા, (ર) જીતેન્દ્રકુમાર મનહરભાઈ, (૩) કલ્પેશકુમાર મનહરભાઈ, (૪) શીરીષકુમાર મનહરભાઈ, (૫) વૈશાલીબેન મનહરભાઈ નાઓ નો વણવહેચાયેલ અવિભાજય ૬૬૭.૮૦ ચો.મી. હિસ્સા સાથે સંયુકત માલિકી, કબજા, ભોગવટા, વહીવટી, વ્યવસ્થા, જાત ખેડની ચાલી આવેલ છે. તેમજ સદરહ જમીનના ૭/૧૨ ના રેકર્ડે માત્ર બળદેવભાઈ ભીખાભાઈ પટેલનું નામ ચાલી આવેલ છે. પરંતુ સદરહુ જમીન ઉપર બળદેવભાઈ ભીખાભાઈ પટેલનો કબજો ભોગવટો ચાલી આવેલ નથી. ઉપરોક્ત હકીકતે અમોએ હિન્દુ વારસાધારાની જોગવાઈ મુજબ વખતો વખત અમોના ભાઈ સન્મુખભાઈ ચુનીલાલ લાડ તથા મનહરભાઈ લાડ ના વારસદારોને મૌખિક તેમજ નોટીસ થી તેમનો ચાલી આવેલ વણવહેચાયેલ અવિભાજય હિસ્સો ખરીદવા અમોના અસીલ ધનસુખભાઈ યુનીલાલ નાઓએ જણાવેલ છતા તેઓ એક યા બીજી રીતે અમોના અસીલ ને તેઓનો વડીલો પાર્જીત વારસાઈ હક્ક. હિત. હિસ્સો વેચાણ કરવાની જગ્યાએ અન્ય ને વેચાણ કરવાની ફીરાકમાં તજવીજ કરતા અમોના અસીલ ધનસુખભાઈ ચુનીલાલે મહેરબાન સુરતના બીજા વધારાના સીવીલ(જૂ.ડી.) જજ સાહેબ ની કોર્ટમા રે.દિ.મુ. નં–૩૧૮/૨૦૨૫ થી અન્ય ૭/૧૨ ના ધારણકર્તા અમોના ભાઈ સન્મુખભાઈ ચુનીલાલ લાડ તથા મનહરભાઈ ચુનીલાલ લાડના વારસદારો કનેથી તેઓનો હિસ્સો હિન્દુ વારસાધારાની કલમ–રર મુજબ વેચાણ દસ્તાવેજથી ખરીદવા અને તે સંબંધી જાહેરાત તથા જાયુકની મનાઈની દાદો માંગેલ છે અને તે દાવાના કામે મજકર જમીનના ટ્રાન્સફર બાબતે તેમજ કબજા બાબતે દરમ્યાન મનાઈ અરજી પણ કરેલી છે. જે પેન્ડીંગ છે અને અમોના અસીલે મજકુર દાવાની **લીસ** પેન્ડન્સીની નોટીસ પણ મહે.કતારગામ સબ-રજસ્ટ્રાર શ્રી સુરત-૪ દક્તરે અનુક્રમે નં-૧૧૩૯૯ થી તા.ર–૮–૨૦૨૫ ના રોજ નોંધાવેલ છે. અમારા અસીલની મજકુર જમીન અંગે ઉપર જણાવેલ ઈસમો સાથે કે અન્ય કોઈપણ સાથે કોઈપણ જાતના ટ્રાન્ફસરના કે કબજાના વ્યવહારો કરવા નહી કે મજકુર જમીનના સ્થળ– સ્થિતીમાં ફેરફાર કરાવવા નહી કે કોઈપણ ત્રાહિત વ્યક્તિ એ મજકુર જમીનના હરકોઈ પ્રકાર ના ટ્રાન્સફરના કોઈપણ રીતે કોઈપણ જાતના લખાણો કરી–કરાવવા નહી. બન્યથા કોઈપણ ઈસમ/સંસ્થા મજકુર જમીન બાબતે અવિચારી પગલુ ભરી મજકુર જમીન અંગે કબજાના લખાણો કે અન્ય કોઈપણ રીતે ટ્રાન્સફરના લખાણો / વ્યવહારો મજકુર ઈસમો કનેથી કરી– કરાવડાવશે તો તેવા વ્યક્તિને દિવાની તકરારમાં સંડોવવાનો વારો આવશે અને તેવી વ્યક્તિઓ વિરૂધ્ધ પણ અમોના અસીલ કાયદેસરની દિવાની તથા ફોજદારી રાહે કાયદેસરના પગલા અમારા અસીલ ભરશે અને તેવી વ્યકિતઓને સ્થળે કબજો પ્રાપ્ત થશે નહી બલકે તકરારથી વિશેષ કાંઈ પણ પ્રાપ્ત થશે નહી.જેની ગંભીર નોંધ લેવી.

ઓફીસ : જાગૃતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, શ્રી ગણેશ મંદિરની સામે, મરિજદની બાજુમાં, પાલનપુર પાટીયા, રાંદેર રોડ,સુરત. મો.નં.૯૩७૪७००४८૧

માહિતી/નવસારી/૩૦૪/૨૦૨૫

(ભૂપેશ આર. પટેલ)

ટેન્ડર નોટિસ (ટુંકી મુદતની નિવિદા)

આથી રસ ધરાવતા ઈસમોને જણાવવાનું કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ાવસારી સંચાલિત નાનીવાલઝર પ્રાથમિક શાળા ના બે ઓરડાનું જુનું મકાન તોડી કાટમાળ લઈ જવા સહિતના ભાવો માંગવવામાં આવે છે, બંધ કવરમાં રૂ. 6,000/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ રાષ્ટ્રીયકૃત બેંકનો SMC NANI VALZAR PRATHMIK SHALA ના નામનો અવશ્ય બિંડાણ કરવાનો રહેશે. ભાવ પત્રક લઇ જવાનો અંતિમ સમય તાઃ 23/08/2025 શનિવારના રોજ 10:00 વાગ્યા સધીનો રહેશે. ભાવપત્રક જમા કરાવવાનો અંતિમ સમય - તારીખઃ 26-08-2025ના રોજ સાંજે 05:00 વાગ્યા સુધી રહેશે. ભાવ પત્રક ખોલવાનો સમય તારીખ 28/08/2025 ના રોજ સવારે 12:30 વાગ્યાનો રહેશે. ભાવ પત્રક શાળામાં (સવારે 11 થી 5) રૂબરૂ જમા કરાવવાનું રહેશે. ભાવ પત્રક મંજૂર કરવા / ન કરવાની સત્તા એસ.એમ.સી નાનીવાલઝર પ્રાથમિક શાળાની અબાધિત રહેશે. જે બાબતે કોઈ પણ કારણ દર્શાવવામાં આવશે નહીં. આની શરતો ભાવ પત્રક લેવા આવો ત્યારે વાંચી સંભળાવવામાં આવશે. ભાવ પત્રક ફી રૂપિયા 500/- રોકડા (નોન રિફંડેબલ) રહેશે.

નોંધ :- અધુરી વિગતોવાળું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્થળ :- નાનીવાલઝર પ્રાથમિક શાળા, તા. વાંસદા જિ. નવસારી

એસ.એમ.સી. અધ્યક્ષ તથા આચાર્યશ્રી નાનીવાલઝર પ્રાથમિક શાળા, તા. વાંસદા જિ. નવસારી

ઓન લાઈન ટેન્ડરીંગ 🚃 માર્ગ અને મકાન વિભાગ જાહેર નિવિદા - ૨૨ સને ૨૦૨૫-૨૬ (ટુંકી નિવિદા)

કાર્યપાલક ઇજનેરશ્રી ભરૂચ (મા.મ) વિભાગ, ગાયત્રીનગર કણબીવગા,

જિલ્લા સેવા સદન ભાગ-૧, પહેલા માળે, ભરૂચ - ૩૯૨૦૦૧ ધ્વારા ગુજરાત રાજયના રાજયપાલશ્રીના નામે અને વતી નીચે જણાવેલ કામના ઓન લાઈન ટેન્ડર માંગવામાં આવે છે. (ફોન નં.૦૨૬૪૨-૨૬૧૩૯૪) ૧. અંદાજીત રકમ અ. કામનં નામ

ળ.	કામપુ પામ	ι.	અદાજીત ૨૩મ
નં.		₹.	બાનાની રકમ
		з.	ટેન્ડર ફ્રી
		٧.	વર્ગ
٩	કન્સ્ટ્રક્શન ઓફ અંકલેશ્વર	٩.	રૂા. ૪,૧૮,૩૯,૫૪૪.૯૬
	રાજપીપળા હાઈસ્પીડ	₹.	રૂા. ૪,૧૯,૦૦૦.૦૦
	કોરીડોર રોડ કિ.મી. ૦/૦૦		રૂા. ૬,૦૦૦.૦૦
	થી ૪૪/૦૦ (મેઈન્ટેનન્સ	٧.	એ વર્ગ અને ખાસ
	ઓફ રોડ યુઝીંગ ગ્રીન		કિક્ષા-૨ (૨સ્તાઓ) અને
	ટેકનોલોજી ઈન મોનસુન		ગ્રીન ટેક્નોલોજી (બેઝ
	સિઝન)		સ્ટેબીલાઈઝેશન) કામના
			અનુભવી ઇજારદારશ્રી

ઉપરોક્ત કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા વિગતવાર નિવિદા https:// tender.nprocure.com વેબસાઇટ ઉપર તા. ૧૪/૦૮/૨૦૨૫ સુધી ઉપલબ્ધ રહેશે. તથા માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders. gujarat.gov.in ઉપર જોવા મળશે. નિવિદામાં થનાર ફેરફાર વેબસાઈટ પર જોવા મળશે.

સેલો વર્લ્ડ લિમિટેડ

મગાઉ સેલો વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી)

માહિતી/ભરૂચ/૩૧૨/૨૦૨૫

ઉપલબ્ધ છે

સ્થળઃ મુંબઈ

Wim Plast Ltd.

કરીને પણ તેને એક્સેસ કરી શકાય છે:

**તારીખઃ** ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫

cello

મંજૂર કરવામાં આવી છે.

સ્કેન કરીને પણ તેને એક્સેસ કરી શકાય છે:

## વેચાણ અંગેની જાહેર નોટીસ

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સુરત સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકા અડાજણ, મોજે ગામ : **પાલણપોર**ના રેવન્યુ સર્વે નં.૮૪, બ્લોક નં.૧૩૧, જેનું રેવન્યુ રેકર્ડ દફતર ૭–૧૨ મુજબ કુલ્લે હે.૩–૭૨–૩૧ આરે. ચો.મી. ક્ષેત્રફળ અને આકાર રૂા.૬૪.૩૧ પૈસા ધરાવતી બીનખેતીની જમીન જેનો **ટી.પી.સ્કીમ નં.૦૯** (પાલણપોર-ભેંસાણ), ફાયનલ પ્લોટ નં.૪૬ તથા પર પૈકી **ફાયનલ પ્લોટ નં.પર** જેનું ક્ષેત્રફળ ૧ ૬૨૫૩ ચો.મી. વાળી રહેણાં કના હેતુ માટે બીનખેતીની જમીનમાં આયોજીત "ઓરેન્જ બંગ્લો" ના નામથી ઓળખાય છે જે સોસાયટીમાં આવેલ રહેણાંકના ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નં ૪૨ વાળી ખુલ્લા પ્લોટ વાળી મીલકત જેનું ક્ષેત્રફળ ૮૫.૬૦ ચો.મી. યાને ૧૦૨.૩૬ ચો.વાર તથા રોડ-રસ્તા અને સી.ઓ.પી.ની જમીનમાં ફાળે પડતી વણવહેંચાયેલ હિસ્સાની પ્રમાણસરની ૪૪.૯૬ ચો.મી. જમીન મળી કુલ્લે ક્ષેત્રફળ ૧૩૦.૫૬ ચો.મી. વાળી ખુલ્લા પ્લોટની મિલકતના માલીક ૧.સુમિત અજ<mark>ચકુમાર મોદી તથા ૨.પ્રિયા સુમિત મોદી</mark> ચાલી આવેલા હોવાનું જણાવી અમારા અસીલ વેંચાણથી રાખવા માંગે છે. અને સદર**હું મીલકત ઉપર એચડીએફસી બેંકની લોન ચાલુ છે.** જેથી સદરહું મીલકતમાં તે સિવાય કોઈ પણ વ્યક્તિ, સંસ્થા યા બેંકનો કોઈપણ જાતનો હકક, હીત, હિસ્સો, લાગભાગ, દરદાવો, કબજો, બોજો, ગીરો, લિયન વિગેરે હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી તેમણે દસ્તાવેજી પુરાવાઓ સહીત દિન–૦૭ માં હમારા નીચે જણાવેલા સરનામે લેખીતમાં જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થયેથી સદરહું મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હકક, હિત, હિસ્સો, સંબંધ, દરદાવો નથી અને હોય તો જતો યાને "વેઈવ" કર્યો છે. તેમ માની આ નોટીસની મુદત વિત્યે હમારા અસીલ સદરહુ મીલકતનો વેચાણ દસ્તાવેજ કરાવી લેશે. ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તર–તકરાર ચાલશે નહીં, જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી.

તા. ૧૨/**૦૮/૨**૦૨૫ ઓફીસ :૧૦૬, પહેલો માળ, સાંઈકૃપા કોમ્પલેક્ષ, ફેન્ડસ કલાસીસની સામે, તાડવાડી, રાંદેર રોડ, સુરત. મો.૯૬૨૪૩૪૩૯૬૨

દક્ષેશ જે. પટેલ

# મોજે ગામ પલસાણાનાં બ્લોક નં. ૧૯૩ થી નોંધાયેલ જમીન અંગેની જાહેર ચેતવણી

સુરત ડિસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ તાલુકા પલસાણાનાં, મોજે ગામ પલસાણાનાં રે.સર્વે નં. ૨૩૪, બ્લોક નં. ૧૯૩ વાળી ખેતીની જમીન, જેનું સુમારે ક્ષેત્રફળ હે. આરે. ૧-૪૨-७૦ ચો.મી., જેનો ખાતા નં. ૭૯૪ અને આકાર રૂા. ૧૯.૩૧ પૈસા વાળી જૂની શરતની ખેતીની જમીનનાં માલીક તથા કબજેદાર અતુલભાઇ રણછોડભાઇ ચાલી આવેલ છે, જેઓએ હમારા અસીલ કનેથી વેચાણ અવેજ પેટે માતબાર રકમ મેળવી હમારા અસીલના લાભમાં તે અંગેના કાયસદેસનાં પાકા લખાણો લખી આપેલ છે. વળી, સદરહુ જમીનની બજાર કિંમત વધી જતા મજકુર જમીનનાં માલીક યાને અતુલભાઇ રણછોડભાઇનાંઓ તેઓનો મલિન ઇરાદો પાર પાડવા માટે, સદરહુ જમીન પરત્વે હમારા અસીલનો ચાલી આવેલ હકક, હિત, હિસ્સાને નુકસાન પહોંચાડી તે જમીન અન્યોને વેચાણ કરવા માટે ફરી રહેલ છે. જેથી હમારા અસીલ હમો મારફત સદરહુ જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવી જણાવી રહેલ છે કે, સદરહુ જમીનમાં હમારા અસીલનો કાયદેસર રીતે હકક, હિત, હિસ્સો ચાલી આવેલ હોવાથી, હમારા અસીલની લેખિત સંમતિ સિવાય કોઇપણ ઇસમોએ કોઇપણ પ્રકારનાં લખાણો, કરારો, વહીવટ-વ્યવહાર, કે નાણાંકીય લેવડ-દેવડ કરવા કરાવવા નહી કે લેખિત પરવાનગી વિના સદરહ જમીનમાં કોઈએ પણ દાખલ થવુ નહી, જેમ કરવામાં કસુર કર્યેથી હમારા અસીલ તેઓ વિરૂધ્ધ ફોજદારી તેમજ સંહિતા રીતની કાયદેસરના પ્રકરણોમાં સંડોવાવુ પડશે સહિ. તેમજ તેઓને સદરહુ જમીન અન્વચે કશા પણ પ્રકારનાં હકક, હિત, હિસ્સા પ્રાપ્ત થશે નહિ, જેની આર્થી સર્વોએ ગંભીર નોંધ લેવી. તા.૧૨/૦૮/૨૦૨૫

<u>ઓફિસ :</u> ૨૦૧, શુભમ્ કોમ્પલેક્ષ, આનંદ હોસ્પીટલની ગલીમા, નાનપુરા, સુરત મો. નં. : હદ્દરર૦૧૫૫૧૫

મારી મારફત : નિરવ આર તેલવાલા (એડવોકેટ)

અધિસુચના ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯७૬ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯७૯ (જુઓ નિયમ-૨૬(૯)) નગર રચના ચોજના નં. ૬૩(વડોદ)

પ્રારંભિક ચોજના ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૯૬ની કલમ-પર ની પેટા ક્લમ-(૧) ની જોગવાઈઓ પ્રમાણે તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ नियमो-१६७६ ना नियम-२६ ना पेटा नियम (६) અનુસાર મેં આજ ता. ०७/०८/२०२५ ने गुरुवारना रोष नगर रचना योषना नं. ६३ (वंडोह), सुरतना નગર રચના અધિકારી તરીકેના પ્રારંભિક ચોજના અંગેના મારા નિર્ણયો જાહેર કર્યા છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અદ્યિનિયમ-૧૯७૬ની ક્લમ-પર ની પેટા ક્લમ (૨) તેમજ ક્લમ-દૃ૪ ની જોગવાઇઓ અનુસાર સદર પ્રારંભિક ચોજના સરકારશ્રીની મંજુરી અર્થે સાદર કરવામાં આવી રહેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯७૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ (૯) ની જોગવાઈઓ અનુસાર નગર રચના અધિકારી તરીકે જે તે પ્લોટો માટે લીદોલ મારા નિર્ણચોના ઉતારા નમુનો-'ઠ' ની નકલ આ ચોજના વિસ્તારમાં સમાવિષ્ટ સંબંધિત જમીન માલિકોને તેમજ હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

ઉપરોક્ત પ્રારંભિક ચોજનાની તમામ માહિતી, નિર્ણયો અને નકશાઓની એક નકલ નગર રચના અધિકારીશ્રીની કચેરીમાં જાહેર રજાના દિવસો સિવાય નીચેના સરનામે કચેરી સમય દરમ્યાન નિરીક્ષણ માટે ખુલ્લા રાખવામાં આવેલ છે. તેમજ સદરહુ ચોજનાની સમજણ આપવા માટે કચેરીમાં જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

તા. ૦७/૦૮/૨૦૨૫ કચેરીનું સરનામું:-નગર રચના અધિકારી અને નગર

**નોંધણી કાર્યાલયઃ** સર્વે નં. ૩૨૪ / ૪ થી ७ કરીગામ, ગામ કરીગામ, દમણ-

CIN L25209DD1988PLC001544 | ਕੇਯੁਣਜ਼ਾਈਟ: www.cellowimplast.com

૩૯૬૨૧૦. ફોન: (૦૨૨) ૬૯૯७००૧૦ **ઇમેલ:** wimplast@celloworid.com

૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે અનઓડિટેડ નાણાકીય પરિણામો

નું સંપૂર્ણ ફોર્મેટ બીએસઈની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.cellowimplast.com પર

લિस्टिंग रेग्युलेशन्सना नियमन ४७ना पालनमां समे सहीं सूचित हरीसे छीसे हे नीचेना हिवह रिस्पोन्स (QR) होडने रहेन

**નોંધણી:** ૫૯७/૨એ સોમનાથ રોડ, દાભેલ, નાની દમણ - ૩૯૬૨૧૦, દમણ અને દીવ CIN: L25209DD2018PLC009865 संपर्ड जंजर: +69 २२ ६66७ 0000

૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટર એન્ડના અનઓડિટેડ

કોન્સોલિડેટેડ અને સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામો

૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટર એન્ડ માટે કંપનીના સ્ટેટ્યુટરી ઓડિટરના મર્ચાદિત સમીક્ષા અહેવાલો

સાથે અનઓડિટેડ નાણાંકીય પરિણામો (કોન્સોલિડેટેડ અને સ્ટેન્ડઅલોન) સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ

ડિસ્કલોઝર રિક્વાચરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલ, ઓડિટ

કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાયેલી તેમની બેઠકોમાં ડિરેક્ટર બોર્ડ દ્વારા

સ્ટેટ્યુટરી ઓડિટરના મર્યાદિત સમીક્ષા અહેવાલો સાથે અનઓડિટેડ નાણાકીય પરિણામો (કોન્સોલિડેટેડ અને

સ્ટેન્ડઅલોન)નું સંપૂર્ણ ફોર્મેટ બીએસઈની વેબસાઇટ www.bseindia.com પર અને નેશન રટોક એક્સચેન્જ લિમિટેડની

લિસ્ટિંગ રેગ્યુલેશન્સના નિચમન ૪૭ના પાલનમાં અમે અહીં સૂચિત કરીએ છીએ કે નીચેના ક્વિક રિસ્પોન્સ (QR) કોડને

વેબસાઇટ www.nseindia.com પર, કંપનીની વેબસાઇટ www.corporate.celloworld.com પર ઉપલબ્ધ છે.

wolleo@soneveirg : มิชห์ช mos. bhowolles. etarogros. www :รชเรอใ

આવી છે અને ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાયેલી તેમની બેઠકોમાં ડિરેક્ટર બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

નિયોજક-3. સુરત નગર રચના ચોજના, એક્મ-ર, સુરત બીજો માળ, જુની વરાછા (ઈસ્ટ) ઝોન

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વતી

વિમ પ્લાસ્ટ લિમિટેડ

એસડી/-

પ્રદીપ જી. રાઠોડ

(સીઈઓ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર)

(DIN - 00050450)

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વતી

સેલો વર્લ્ડ લિમિટેડ

એસડી/-

પ્રદીપ જી. રાઠોડ

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

DIN-00050450

ઓફ્સિ, ઝવેરચંદ મેઘાણી બાગની પાછળ મીની બજાર, વરાછા, સુરત-૩૯૫૦૦૬ ફોન:- ૦૨૬૧-૨૫૪૪૮૨૩ Email Id: stp-tpo2-srt@gujarat.gov.in

(પી.એન.તિવારી) નગર રચના અધિકારી અને નગર નિયોજક-3, સુરત નગર રચના યોજના એકમ-૨,

ક્રમાંક ઃ માહિતી-સૂરત/દૃદ્દપ/૨૦૨૫

#### ડિસ્ટ્રીકટ - નવસારી, સબ-ડિસ્ટ્રીકટ નવસારીના મોજે ગામ : સીસોદ્રા (ગણેશ) ના બ્લોક નં. ૧૦૨૬ વાળી જુની શરતની ખેતીલાયક જમીનના વેચાણ અંગેની જાહેર નોટીસ

આથી લાગતા-વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ નવસારી, સબ ડિસ્ટ્રીક્ટ નવસારીના મોજે ગામ : સીસોદ્રા(ગણેશ)ના બ્લોક નં. ૧૦૨૬ વાળી જુની શરતની ખેતીલાયક જમીન ૧.કલ્પેશ દિલીપભાઇ દેસાઇ ૨.મિતલ દિલીપભાઇ દેસાઇ ૩.કેશવી કલ્પેશ કુમાર દેસાઇ તે હિત વશી ની પત્ની ૪.સગીર હેતશ્વિ કલ્પેશ કુમાર દેસાઈની સંયુક્ત માલિકી કબજા ભોગવટા, વહીવટ, વ્યવસ્થાની ચાલી આવેલી છે. જમીનના માલીકોનું નામ સદર જમીનનાં રેવન્યુ રેકર્ડમાં માલીક, કબજેદાર તરીકે પણ ચાલી આવેલ છે. જે જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે. આથી સદરહું જમીન પરત્વે કોઈપણ વ્યક્તિ, વંશ વાલી, વારસદારો, બેંક કે સંસ્થાનો કોંઇપણ પકારનો વાંધો-વિરોધ, લાગભાગ, કબજો, ગીરો, વેચાશ હકક, માલીકી હકક, હિસ્સો, હિત, સંબંધ, અધિકાર, ચાર્જ બોજો, ધીરાશ, મોર્ગેજ, કરજ, ગીરો હકક, ભાડા હકક, સાટાખત હકક, દાવો ફરીયાદ કે ઇઝમેન્ટ હકક, વપરાશી હકક હોય તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં હમોને પુરાવા સહિત લેખિતમાં જાણ કરવી. આ નોટીસની મુદત વિત્યા બાદ સદરહું જમીનોમાં કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો-વિરોધ, તર–તકરાર, લાગભાગ. હકક. હિસ્સો, હિત, સંબંધ, અધિકાર, ચાર્જ નથી યાને રાજીખુશીથી છોડી દીધો છે તેમ માની સદરહું મિલકતનો હમારા અસીલ પાકો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અમારા અસીલના નામે કરી કારાવી લેવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં તે અંગેની કોઇની કોઈપણ પ્રકારની તર-તકરાર, દાવા-દુવી, ફરીયાદ અને વાંધો યાલશે નહી જેની સ્પષ્ટ નોંધ લેવી.

અમારા અસીલની સુચના અને ફરમાઈશ અન્વરો ઓફિસ : ૩૦૫–૩૦૬, ટાઈમ્સ સ્કેવર, જી.ડી. ગોરોનકા સ્કુલ સામે, કેનાલ રોડ, વેસુ, સુરત. મો. લ્૩૨૮૫ ૮७०००

મારી મારફત : અમી બી. વખારિયા (એડવોકેટ એન્ડ નોટરી)

વેકેન્ઝા બંગ્લોઝનાં પ્લોટ નં. ૨૧ વાળી મિલકતનાં વેચાણ અંગે અનામી ખરીદનારાએ એક્વોકેટ હિમાંશુ જી. વાંસીચા મારફતે આપેલ

જાહેર નોટીસ સામે વાંધો/વળતી નોટીસ મોજે વેસુની સીમમાં આવેલ જુનો સર્વે નં. ૪૮, નવો સર્વે નં. ૪૧/પૈકી ૧, ટી.પી. સ્કીમ નં.૧, ફાયનલ પ્લોટ નં. ૮૬ વાળી જમીનમાં બાંધવામાં આવેલ **''વેકેન્ઝા બંગલોઝ''** માં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨૧ વાળી ખુલ્લા પ્લોટવાળી મિલકત અંગે દિમાંશુ જી. વાંસીયા

એડવોકેટ મારફતે અનામી ખરીદનારાઓએ ગુજરાત મિત્ર દૈનિકની તા.03/0૮/૨૦૨૫ નાં રોજની આવૃત્તિમાં પાના નં. (૨) ઉપર મજકુર મિલકત વેચાણ અંગે જે જાહેર નોટીસ છપાવેલ

હમારી મારફત

છે તેની સામે હમારો વાંધો નીચે મુજબ છે. ઉપર જણાવેલ **''વેકેન્ઝા બંગ્લોઝ''** માં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. ૨૧ હમોએ મજકુર લોટનાં માલિક અમિષ અમરતભાઈ ભ્રમભક્ર નાઓ પાસેથી કાયદેસર રીતે વેચાણથી રાખેલ છે અને તેનાં અવેજ પેટે ઘણી મોટી રકમ કાયદેસર રીતે ચુકવી આપેલ છે અને આમ મજકુર મિલકતમાં હમારો કાયદેસર રીતે હકક, હિત, હિસ્સો સમાયેલો છે અને હમો ઉપરોક્ત જમીનનાં માલિક અમિષ અમરતભાઈ ભ્રમભક્ર પાસેથી પોતાના લાભમાં રજી. વેચાણ દસ્તાવેજ કરાવી લેવા માંગીએ છીએ પરંતુ તેઓની દાનત હમારી મજકુર પ્લોટનાં અવેજ પેટે યુકવેલી રકમ સ્વીકારી લીધા બાદ ફરીવાર અન્ય કોઈ ત્રાહિત ઈસમને વેંચાણ કરવા ફરી રહયા છેં જેની સામે હમારો સખત વાંધો છે અને જલ્દથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરનાર છે અને તેથી જો કોઈ પણ વ્યકિત મજકુર મિલકત અંગે અમિષ્ર અમરતભાઈ ભ્રમભહ કે અન્ય કોઈપણ ઈસમ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરશે તો તેને તકરારથી વિશેષ કંઈ પ્રાપ્ત થશે નહીં અને નાછુટકે દિવાની તથા ફોજદારી કાર્ચવાહીમાં સંડોવાવવું પડશે સહી અને ોનાં ખર્ચ અને પરીણામની જવાબદારી જે તે ઈસમની રહેશે સહી. જેથી એડવોકેટ હિમાંશુ જી. વાંસીયાનાં અનામી ખરીદનારાને તથા અન્ય જાહેર જનતાને આ વાંધો આપી જણાવવવાનું કે, ઉપરોક્ત જણાવેલ મિલકત અંગે અમિષ્ઠ અમરતભાઈ ભ્રમભક સાથે કોઈપણ પ્રકારના કોઈપણ વ્યવહાર કરવા કરાવવા નહીં અને જો તેમ છતાં કરવામાં આવશે તો તેઓને તકરારથી વિશેષ કંઈ પ્રાપ્ત થશે નહીં, જેની નોંધ લેશોજી.

Boizaum 27 muny કનૈયાલાલ સનમુખલાલ ખરવર **ઝકી મુખ્તીચાર શેખ**-એક્વોકેટ હે.૧૦૯, મીરામ્બીકા કોમ્પલેક્ષ, ગાંધી બાગ સામે, નાનપુરા, સુરત. સૌનક કમલેશભાઈ પટેલ

મોજે ગામ ઓલપાડ તા. ઓલપાડ, જી. સુરતના રે.સર્વે નં. ૩૪૮/૩, બ્લોક નં. ૫૧૫ વાળી નોટીસ અંગે જાહેર જવાબ, નોટીસ તથા જાહેર ચેતવર્ણ મોજે ગામ ઓલપાડ તા.ઓલપાડ, જી. સુરતના રે.સર્વે નં.૩૪૮/૩, બ્લોક નં.૫૧૫

વાળી નોટીસ અંગે જાહેર જવાબ, નોટીસ તથા જાહેર ચેતવણી ગત તા.૦૭/૦૮/૨૦૨૫ ના રોજ ગુજરાત મિત્ર દૈનિક વર્તમાનપત્રમાં સંદિપ કે. ચિત્તે તે મોહમદસલીમખાન અબ્દુલરહીમખાન ચાહવાલાનાં એડવોકટ મારફત પાઠવવામ આવેલ જાહેર નોટીસ તથા જાહેર ચેતવણી નો જાહેર જવાબ, નોટીસ તથા જાહેર ચેતવણી અમોના અસીલ વઝીર અહમદખાન ના કુલ મુખત્યાર સલીમ ઈસ્માઈલ અસમાલની સુચના અને ફરમાઈસ મુજબ પાઠવીને જણાવવાનુ કે,

મોજે ગામ ઓલપાડ તા. ઓલપાડ, જી. સુરતના રે.સર્વે નં. ૩૪૮/૩, બ્લોક નં. ૫૧૫ ખાતા નં.૧૫૫, જેનું ક્ષે.હે.આરે.ચો.મી. ૧–૫૪–૭૯, આકાર ૧૫.*૬*૨ પૈસા વાળી ખેડખાતાની વાળી જમીન મિલકત મહુંમ ઝુબેદાબીબી તે દીલાવરખાં રહીમખાંની છોકરી ની માલીકી ભોગવટાની ચાલી આવેલ છે. જેઓ વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહેતા આવેલ હોય અને મહુંમે અહમદખાન સાથે તા.૦૪/૦૮/૧૯૫૦ ના રોજ લગ્ન કરેલ હોય અને તેઓનું તા.૦૬/૦૭/૨૦૦૫ ના રોજ સાઉથ આફ્રિકા મુકામે અવસાન થયેલ હોય અને તેમના સીઘીલીટીના કાયદેસરના વારસમાં પુત્ર રાસીદ અહમદખાન મરણ તા.૨૪/૦૨/૧૯૭૦ ના રોજ તથા વઝીર અહમદખાન નાઓ છે. અમોના અસીલ વર્ષોથી સાઉથ આફ્રિકા મુકામે રહેતા હોય અમોના અસીલની માતાના નામે ચાલી આવેલ ઉપરોક્ત જમીન મિલકત સંબંધે અમો ના અસીલ દવારા વારસાઈ નોધ પડાવતા અમોના અસીલના મર્હુમ માતાશ્રી ના ભળતા નામવાળી વ્યક્તિના કહેવાતા વારસદારો મોહમદ સલીમખાન અબ્દલરહીમખાન ચાહવાલા તથા અન્ય દવારા ખોટી રીતે અને બદદાનતથી અમોના અસીલની વારસાગત જમીન મિલકત પચાવી પાડવાના બદ ઈરાદે ભળતા નામનો ગેરલાભ લેવા તેમજ ખોટા અને બોગસ લખાણો અને દસ્તાવેજો ઉભા કરી અને પોતાને વારસદાર દર્શાવવા ખોટુ અને બોગસ પેઢીનામું કરી અમોના અસીલ દવારા કરવામાં આવેલ વારસાઈ નોધ નં.૨૦૭૭૮ માં ખોટી રીતે વાંધો ઉપસ્થીત કરતા ઓલપાડ પ્રાંત સાહેબ દવારા ઝુબેદાબીબી ના બે અલગ અલગ મરણના દાખલા તથા બે અલગ અલગ પેઢ ીનામા રજુ થયેલ હોય તેમજ સાચા વારસદારો કોણ છે તે નકકી કરી શકાય તેમ ન હોવાથી સદર નોધ નામંજૂર કરેલ છે. જેને સદર જાહેર નોટીસમાં ખોટી રીતે પોતાના બદ ઈરાદે જ્ણાવી પાઠાફેર હેકીકતો વાળી ખોટી જાહેર નોટીસ પ્રસિઘ્ધ કરેલ હોય જેથી હાલની આ જાહેર નોટીસનો જાહેર જવાબ, નોટીસ, તથા જાહેર ચેતવણી પાઠવવા અમોના અસીલને

સબબ, લાગતા વળગતા તમામને તથા જાહેર જનતાને જણાવવાનુ કે, સદરહ જમીનના અમોના અસીલ કાયદેસરના માલીક મુખત્યાર તથા વહીવટદાર ચાલી આવેલ છે તેમ છતાં ભળતા નામનો લાભ લઈ અમોના અસીલની કાયદેસરની વારસાગત જમીન મિલકત પચાવી પાડવા અમુક ઈસમો તેમની ખોટી તકરાર લઈ સદરહુ જમીન મિલકત પચાવી પાડવાના પ્રયત્ન કરી રહેલ હોય જેથી અમોના અસીલની લેખીત સંમતી વિન સદરહુ મિલકત સબંધે કોઈપણ પ્રકારના ગેરકાયદેસરના લખાણો કે વ્યવહારો કોઈપણ વ્યક્તિ સાથે કરવા નહી તેમ છતાં અમોના અસીલ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ સાથે સદરહુ મિલકત સબંધેના વ્યવહાર, લખાણો કરવામાં આવશે તો તેઓને તકરાર સિવાય કઈ જ પ્રાપ્ત થશે નહી તેમજ ફોજદારી તથા દિવાની પ્રકરણોમાં સંડોવવાનો વારો આવશે જેની લાગતા વળગતા તેમજ જાહેર જનતાએ સ્પષ્ટ અને ગંભીર નોંધ લેવી. અસીલની સુચના મુજબ અમોના મારફત.

સુરત, તા. ૧૧/૦૮/૨૦૨૫ ઓ. નં. ૧, પ્રયાગ એપાર્ટમેન્ટ, પાસે, ગીતાંજલી, વરાછ રોડ, સુરત

જીતેન્દ્ર જે. ઉપાધ્યાય ગાયત્રી ખમણની ઉપર, હોટલ જીવનધારા તે વઝીર અહમદખાનના કુલમુખત્યાર સલીમ અસમાલના એડવોકેટ

# મોજે ગામ અટોદરા તા. ઓલપાડ ખાતે આવેલ બ્લોક નં. ૨૩-ક વાળી જમીન સંદર્ભે જાહેર નોટીસ તથા જાહેર ચેતવણી

મોજે ગામ અટોદરા , તા . ઓલપાડ , જી . સુરત ખાતે આવેલ બ્લોક નં . ૨૩-ક વાળી ખેતીની જમીન પૈકી ૯૧૦૫ ચો . મી . જમીન મર્દુમ ચંદ્રવદન ડાહચાભાઈ બારોટ નાઓએ હમારા અસીલ મુબીનુદ્દીન ઈલ્લુદ્દીન મિરઝાનાઓની પાસેથી કાયદેસરનો વેચાણ અવેજ સ્વીકારી કબજા સહિતનો વેચાણ કબજા સહિતનાં વેચાણ કરારમાં નેહલ કાંતિલાલ અનિલ તથા રઈશ ઈરમાઈલ મિરઝા નાઓને સાક્ષી તરીકે સહી કરેલ છે અને સદરહું કબજા સહિતનો વેચાણ કરાર હમારા મુળીનુદ્દીન ઈલ્લુદીન મિરઝાનાં લાભમાં થયેલ હોવાની હકીકત જમીનનાં મુળ માલિકોની જાણકારીમાં લાવવામાં આવેલ અને વેચાણ અવેજ સ્વીકારેલ અંગેની પણ હકીકત જમીનનાં મુળ માલિકોની જાણકારીમાં લાવવામાં આવેલ **અને જે તે સમયે યાને કે તા.૧૨/૦૧/૨૦૧૫ નાં રોજ હમારા** અસીલ પાસેથી અવેજ સ્વીકાર્યા બાદ તથા લખાણ કર્યા બાદ હમારા અસીલને સદરહું બ્લોક નં. ૨૩-ક વાળી જમીનનો કબજો માલિકી હકકે શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો સુપ્રત કરેલ અને ત્યારથી સદરનું બ્લોક નં. ૨૩-ક વાળી જમીનનાં માલિક, મુખત્યાર અને કબજેદાર તરીકે હુમારા અસીલ ચાલી <u>આવેલ છે.</u> પરંતુ સને-૨૦૧૫ માં બ્લોક વિભાજનની કાર્યવાહી કરવાની બાકી હોય જમીનનાં મુળ માલિકોએ તથા મર્હુમ ચંદ્રવદન ડાહયાભાઈ બારોટ તથા બ્લોક વિભાજનની કાર્ચવાહી કરવામાં આવેલ અને જમીનનાં મુળ માલિકોએ મર્હુમ ચંદ્રવદન ડાહચાભાઈ બારોટનાઓનું નામ રેવન્થુ રેકર્ડ ઉપર દાખલ કરાવ્યા વિના સદરહું જમીનનાં હમારા અસીલ કાયદેસરનાં લખાણથી માલિક, મુખત્થાર બનેલ હોવાનું જાણતા હોવા છતાં હમારા અસીલ સાથે વિશ્વાસઘાત અને છેવેંટપીડી કરવાના ગુનાઢીત ઈરાદે સદરહું જમીન અંગેનાં બોગસ, બનાવટી અને ફોર્જડ વેંખાણો બિપીનભાઈ નરસિંહભાઈ કથિરિયા તથા દિનેશભાઈ બાબુભાઈ અમરેલીચાનાઓનાં લાભમાં તા. ૧૯/૦૫/૨૦૧૫ નાં રોજ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં .૮૦૫૪/૨૦૧૫ થી લખી આપેલ અને ત્યારબાદ સને-૨૦૧૯ નાં અરસામાં મહુંમ ચંદ્રવદન ડાહચાભાઈ બારોટનાં વીલ ચાને વસીચતનામાનાં આધારે ચારૂલ જીતેન્દ્ર બારોટ નાઓએ સુધારાનો દસ્તાવેજ તેમજ અન્થ બોગસ અને બનાવટી લખાણે કરેલ જે સંદર્ભે હમારા અસીલનાં કુલમુખત્થાર મોહંમદ સમીર અબ્દલ લતીક મલેક નાઓએ અશ્રેનાં ઓલપાડ પો.સ્ટે.માં ઓલપાડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૨૨૧૧૪૯/૨૦૨૨ થી ઈ.પી.કોડ કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦ મુજબની એક ફરીચાદ જમીનનાં મુળ માલિકો તથા મહુંમ ચંદ્રવદન ડાહચાભાઈ બારોટ, નેહલ કાંતિલાલ અનિલ તથા ચારૂલ જીતેન્દ્ર બારોટ નાઓ વિરૂદ્ધ ઑપેલ છે કાંતિલાલ અનિલ તથા ચારૂલ જીતેન્દ્ર બારોટ વિગેર્ટનાઓ વિરૂદ્ધ ગુનો નોંધાચા બાદ તેઓ તર્ફે ઓલપાડ મુકામે જમીનની દલાલી કરતા અમિત સત્યનારાય અગ્રવાલ ઉર્ફે લાલુ સાંઘીયેર નાઓએ હમારા અસીલનો સંપર્ક કરી સદરહું બ્લોક નં. ૨૩-ક વાળી જમીન બાબતે સમાધાન કરવા દાબ દબાણ કરેલ પરંતુ હમારા અસીલે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડેલ છે. સદરહું ઓલપાડ મુકામે દાખલ થયેલ એફ.આઈ.આર. બાદ બિપીનભાઈ નરસિંહભાઈ કીથીરીયાં તથા દિનેશભાઈ બાબુભાઈ અમરેલીયાનાં લાભમાં કરવામાં આવેલ દસ્તાવેજ રદ કરવા સંદર્ભેની પણ કાર્યવાહીઓ થયેલ હોવાની હમારા જાણતા હોવા છતાં ચારૂલ જીતેન્દ્રભાઈ બારોટનાઓએ સદરહું બ્લોક નં . ૨૩-ક સંદર્ભે તા.o૫/o૯/૨૦૨૩ ના રોજ એક અન્થ બોગસ અને બનાવટી વેચારા દસ્તાવેજ (૧) માસુમખાન ચુસુકખાન પઠાણ, (૨) અહમદ ઈકબાલ બચાવ નાઓનાં લાભમાં ઓફલાઈન વેચાણ દસ્તાવેજ કરેલ હોવાની તથા (૧) માસુમખાન ચુસુકુખાન પઠાણ , (૨) અહમદ ઈકબાલ બચાવનાઓએ સદરહું બ્લોક નં . ૨૩-ક વાળી જમીન સંદર્ભે વધુ એક બોગસ અને બનાવટી ફોર્જડ વેચાંણ દસ્તાવેજ તા.૦૩/૦૨/૨૦૨૫ નાં રોજ મહેન્દ્ર રમણીકભાઈ મોરડીચા (જલભુમિ) નાઓનાં લાભમાં કરેલ હોવાનું પણ હમારા અસીલની જાણકારીમાં આવેલ છે. હમારા અસીલ તે સંદર્ભે પણ બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા સંદર્ભે (૧) ચારૂલ જીતેન્દ્ર બારોટ,(૨) નેહલ કાંતિલાલ અનિલ (૩) માસુમખાન ચૂસુકખાન પઠાણ, (૪) અહમદ ઈકબાલ બચાવ, (૫) મહેન્દ્ર રમણીકભાઈ મોરડીયા (જલભૂમિ) તથા જમીન દલાલ (રુ) અમિત સત્યનારાય અગ્રવાલ ઉર્ફે લાલુ સાંદીયેરનાઓ વિરૂદ્ધ કાયદેસરની લેખિત પોલીસ ફરીયાદ આપેલ છે.

હમારા અસીલનો લાભમાં સદરહું ગામ–અટોદરા , તા . ઓલપાડ મુકામે આવેલ બ્લોક નં . ૨૩-ક વાળી જમીનનાં કાયદેસરનાં લખાણો થયેલ હોચ અને હમારા અસીલ સદરહું જમીનનાં માલિક, મુખત્થાર અને કબજેદાર તરીકે હાલમાં પણ ચાલી આવેલ હોચ ત્યારબાદ પણ ઉપરોક્ત જણાવેલ ઈસમો દ્વારા વારંવાર સદરહું જમીનનાં બોગસ, બનાવટી અને ફોર્જડ લખાણો ઉભા કરવામાં આવી રહ્યા છે અને તે સંદર્ભે ગુનાહીત ધાક ધમકીઓ આપવામાં આવી રહેલ હોચ સદરહું જમીન બ્લોક નં. ૨૩-ક બાબતે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઈસમે હાલની જાહેર નોટીસ તથા જાહેર ચેતવણી બાદ કોઈપણ લખાણો કે અન્ય કોઈ દસ્તાવેજો કરવા કરાવવા નહીં . જો કોઈ વ્યક્તિ , સંરથા કે ઈસમો હાલની નોટીસ બાદ પણ કોઈ લખાણો કે દસ્તાવેજો કરે ખાસ નોંધ : નેહલ કાંતિલાલ અનિલ નાઓ વિરૂદ્ધ સુરત મુકામે ચેક રીર્ટનનાં ઘણાં બધા કેસો પેન્ડીંગ છે. આ ઉપરાંત નેહલ કાંતિલાલ અનિલ વિરૂદ્ધ (૧)

<del>ફરીયાદો પણ થયેલ છે.</del>

મારી મારફત : કેતન પી. રેશમવાલા (એડવોકેટ)

### ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે અનઓડિટેડ નાણાકીય પરિણામો (સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ) અને સ્ટેટ્યુટરી ઓડિટરના મર્યાદિત સમીક્ષા અહેવાલ સાથે , જે સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્કલોઝર આવશ્ચકતાઓ) ના નિયમનો, ૨૦૧૫ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાચેલ છે અને ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં સ્ટેટ્યટરી ઓડિટરના મર્યાદિત સમીક્ષા અહેવાલ સાથે અનઓડિટેડ નાણાકીય પરિણામો (સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ)

કરાર લખી આપેલ તા.૧૮/૦૧/૨૦૧૫ નાં રોજ નોટરી પબ્લીક શ્રી ઈશ્વરલાલ જે. ચૌધરી નાઓ રૂબરૂ અનુક્રમ નં. ૨૦/૨૦૧૫ થી નોટરાઈઝડ થયેલ છે જે કાયદેસરનો વેચાણ દસ્તાવેજ લખી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપેલ. સદરહું બ્લોક નં. ૨૩-ક વાળી જમીનમાં હમારા અસીલની જાણકારી બહાર જે ફરીચાદનાં કામે હાલ નામદાર ઓલપાડ કોર્ટમાં સદરહું એફ.આઈ.આર. સંદર્ભેની કાર્ચવાહીઓ પેન્ડીંગ છે. સદરહું ઓલપાડ પો.સ્ટે. માં નેહલ અસીલની જાણકારીમાં છે અને હાલમાં સદરહું બ્લોક નં. ૨૩-ક વાળી જમીનનાં હમારા અસીલ કાયદેસરનાં માલિક , મુખત્થાર અને કબજેદાર હોવાનું

કરાવશે ચા અન્ય કોઈ રીતે મદદગારી કરશે તો તેવા તમામ વિરૂદ્ધ હમારા અસીલ પોલીસ ફરીચાદ કરશે , જેની આથી જાહેર જનતાએ નોંધ લેવી . ઓલપાડ પો.સ્ટે.ફ.ગૂ.૨.નં. ૪૩/૨૦૧७, (૨) ઉમરા પો.સ્ટે.ફ.ગૂ.૨.નં. ૨७૦/૨૦૧૬, (૩) ઓલપાડ પો.સ્ટે.ફ.ગૂ.૨.નં. ૪૦/૨૦૧૮ મુજબની પોલીસ

Sumir muler (મોહંમદ સમીર અબ્દુલ લતીફ મલેક તે મુબીનુદ્દીન ઈલ્લુદ્દીન મિરઝાનાં કુલમુખત્યાર)

૫૦૯, ''આઈકોન બીઝનેસ હબ'', સુરત-ડુમસ રોડ, સુરત.